



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦,૨૫૬૩૦૩૦૦,૨૫૬૩૦૪૦૦

ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૧૧/૨૦૧૪ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી ૨૮૬૪/૧૪

વટવા પોલીસ સ્ટેશન:-

વટવા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૩૪૪/૧૪ ઈપીકો કલમ ૩૨૩,૩૭૬,૪૨૦,૩૪ તથા પોસ્કો એક્ટની કલમ ૩,૪ મુજબ મુજબના કામના આરોપી (૧). પ્રતાપભાઈ રઈજીભાઈ દરબાર ઉવ-૪૨ રહે-એ/૨૬ શ્રી રામ નગર બચુભાઈનો કુવો વટવા તથા (૨). હાર્દીકભાઈ પ્રતાપભાઈ દરબાર ઉવ-૨૬ રહે-એ/૨૬ શ્રી રામ નગર બચુભાઈનો કુવો વટવા નાને સીની.પો.ઇન્સ.શ્રી એચ.જે.ચૌધરી સા.નાઓએ તા.૨૧/૧૧/૨૦૧૪ ના કલાક ૧૩/૩૫ વાગે પકડી અટક કરી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશન:-

દાણીલીમડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૨૨૫/૨૦૧૪ ઈપીકો કલમ ૩૬૩,૩૭૬,૩૭૭,૫૦૬(૧), તથા પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફોર સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ૨૦૧૨ ની કલમ ૪ મુજબના કામના કામે ફરીયાદીની દિકરી ઉવ.૧૦ વર્ષ નાની તા:૨૧/૧૧/૨૦૧૪ ના બપોરના ૧૩/૦૦ વાગે દાણીલીમડા અલ મદીના મસ્જીદ પાસે શુક્રવાર હોય મસ્જીદની આગળ પૈસાની લાલચમાં બેઠેલ દરમ્યાન એક રિક્ષા ડ્રાઈવર તેને બોલાવી સદકાના પૈસા રૂપીયા એક હજાર આપવાની લાલચ આપી રિક્ષામાં બેસાડી દાણીલીમડા કચરાના ઢગલા બાજુ કોઈ જંગલની ઝાડીમાં લઈ જઈ ખરાબ કૃત્ય કરતા નજીકથી માણસો પસાર થતાં તેણીને કપડાં પહેરાવી અને રિક્ષામાં બેસાડી પરત દાણીલીમડા સરકારી સ્કુલની પાસે ઉતારી દઈ આ બાબતે કોઈને જાણ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ આ વખતે છોકરીએ રિક્ષા જતી હતી તે વખતે તેની પાછળ લખેલ નંબર ૨૪૮૮ વાંચેલ હતો બનાવ સબંધે ફરીયાદીએ પોતાની ફરીયાદ આપતાં ઉપરોક્ત નંબરથી ગુનો દાખલ કરી ભોગ બનનાર છોકરીએ જણાવેલ રિક્ષા નં-૨૪૮૮ ની એકલવ્ય સોફ્ટવેરમાં આ નંબરની રિક્ષાઓ સર્ચ કરાવતા શાહઆલમ ખાતે રહેતાં જાવેદ ઉર્ફે થકેલી અત્રેના પોલીસ સ્ટેશનનો હીસ્ટ્રીશીટર અને ઘરફોડ ચોરીઓમાં પકડાયેલ હોય અને નામચીન હોય જેથી સર્વેલન્સ સ્કોડના માણસો મારફતે તપાસ કરાવડાવી તેને ઓટો રિક્ષા નં-જીજે-૦૧-બીવાય-૨૪૮૮ ની સાથે પકડી પાડેલ જે ઉપરોક્ત જાવેદ ઉર્ફે થકેલી ઉર્ફે ચોર અજીજખાન બચુખાન પઠાણ નાને જોતાં ભોગ બનનારે સદરહું ઓટો રિક્ષા ચાલકનું જણાવેલ વર્ણન અંગે ખરાઈ કરતાં તેનો એક દાંત તુટેલ જણાઈ આવેલ અને સદરીની ધનિષ્ટ પુછપરછ કરતાં પોતે ગુનાની કબુલાત કરતાં સદરી જાવેદ ઉર્ફે થકેલી ઉર્ફે ચોર સન/ઓફ અજીજખાન બચુખાન પઠાણ (ઉ.વ.૩૫) (રહે,શાહનગર બોરા એસટીડીની ગલીમાં ચોકીદારબાવાની દરગાહની સામે શાહઆલમ)ને ઉપરોક્ત ગુનાના કામે તા.૨૨/૧૧/૨૦૧૪ બપોરના ૨/૩૦ વાગે પકડી અટક કરવામાં આવેલ છે. હાલમાં આ ગુનાની વધુ તપાસ ચાલું છે.

નાયબ પોલીસ કમિશનર  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર  
પોલીસ કમિશનર વતી.